

પ્રતિ,  
તંત્રીશ્રી,  
દૈનિક.....

તા.

૨૬/૦૧/૨૦૨૩

રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઓન ખાતે ૭૪માં પ્રજાસત્તાક પર્વ-  
૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી.

માન. મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવએધ્વજવંદન કરી, રાષ્ટ્ર ધ્વજને સલામી  
આપીતેમજ શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી



રાજકોટ મહાનગરપાલિકા નીસેન્ટ્રલ ઓનકચેરી ખાતે તા.૨૬ જાન્યુઆરી ૨૦ ૨૩ના રોજ  
૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રધ્વજ સલામી સમારોહમાં માન.મેયરશ્રી ડૉ. પ્રદિપ

ડવએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તેમજ શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા આપી હતી.

આ પ્રસંગે માનનીય સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર અને ધારાસભ્યડૉ.દર્શિતાબેન શાહ , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ,મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ ઇંડક સુરેન્દ્રસિંહ વાળા , રાજકોટ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, ડે.મ્યુનિસિપલ કમિશનર સી. કે. નંદાણી,આશિષ કુમાર આ ઉપરાંત જુદી જુદી કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ મનીષભાઈ રાડિયા, પરેશભાઈ પીપળીયા,દેવાંગભાઈ માંકડ, અશ્વિનભાઈ પાંભર, નરેન્દ્રભાઈ ડવ, રણજીતભાઈ સાગઠીયા, વિનોદભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, નીરૂભા વાઘેલા, નીતિનભાઈ રામાણી, જીતુભાઈ કાઠોડીયા, ડૉ. અલ્પેશભાઈ મોરજરીયા, રસીલાબેન સાકરીયા, કંચનબેન સિધ્ધપુરા, જયાબેન ડાંગર, નયનાબેન પેઢીયા, મિતલબેન લાઠીયા, દુર્ગાબા જાડેજા, ડૉ. દર્શનાબેન પંડ્યા, જયોત્સનાબેન ટીલાળા, ડૉ. રાજેશ્રીબેન ડોડીયા, ભારતીબેન પરસાણા, દેવુબેન જાદવ, મંજુબેન કુંગસીયા, સોનલબેન સેલારા, કંકુબેન ઉધરેજા, જયશ્રીબેન ચાવડા, આશાબેન ઉપાધ્યાય, કલ્પનાબેન ક્રિયાડા, મીનાબા જાડેજા, વર્ષાબેન પાંધી, લીલુબેન જાદવ, વજીબેન ગોલતર, અલ્પાબેન દવે તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ મ્યુનિસિપલ સેક્રેટરી ડૉ. એચ.પી. રૂપારેલીઆ, સિટી એન્જીનીયર પી.ડી.અઢિયા, વાય.કે.ગોસ્વામી,અલ્પના મિત્રા,હેલ્થ ઓફિસર ડૉ. જયેશ વકાણી, સુરક્ષા અધિકારી આર.બી. ઝાલા, પર્યાવરણ અધિકારી નિલેષ પરમાર, ગાર્ડન ડાયરેક્ટર ચૌહાણ, ટાઉન પ્લાનીંગ ઓફિસર સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર, આસી.કમિશનર હર્ષદ પટેલ, વાસંતીબેન પ્રજાપતિ, બી.ડી.જીવાણી,પી.એ. ટુ કમિશનરએન. કે. રામાનુજ,નાયબ ફાયર ચીફ ઓફિસર ઠેબા, કે. એચ. હિંડોયા, સી.એન.રાણપરા,પી.એ. ટુ ચેરમેન એચ. જી. મોલીયા, આસી.મેનેજર કૌશિક ઉનાવા, લખતરીયા , કાશ્મિરા વાઢેર, વત્સલ પટેલ, જય ગજજર તેમજ રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાના અધિકારી/કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

પ્રજાસત્તાક પર્વ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી શ્રેષ્ઠ સફાઈ કામદાર શ્રી ધવલભાઈ રામજીભાઈ વાઘેલા, શ્રી સીતાબેન વજીભાઈ ગોહેલ, શ્રી શારદાબેન મોહનભાઈ સોલંકી, શ્રી પરેશભાઈ અરવિંદભાઈ વાઘેલા, શ્રી મંગુબેન ધનજીભાઈ ચૌહાણ અને શ્રી અમિતભાઈ રવજીભાઈ ગોહેલનું મેયર સહિતના જુદાજુદા મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી તેમજ પ્રમાણપત્ર આપી, સન્માન કરવામાં આવેલ.

## ૨૬ જાન્યુઆરી-૨૦૨૩ પ્રજાસત્તાક પર્વ ઉજવણી પ્રસંગે માન. મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવનો શહેરીજનોને શુભેચ્છા સંદેશ

“ચલો ફિર સે આજ વો નજારા યાદ કર લે,  
શહીદો કે દિલ મેં થી વો જ્વાલા યાદ કર લે.  
જીસમેં બહકર આઝાદી પહુંચી થી કિનારે,  
દેશભક્તો કે ખુન કી વો ધારા યાદ કર લે”.

આજે ભારતના ૭૪માં પ્રજાસત્તાક પર્વ નિમીત્તે સૌ શહેરીજનોને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું. દેશને આઝાદી અપાવનાર તમામ ક્રાંતીવીરો શહીદોને નમન કરું છું. ભારત દેશ ૧૯૪૭માં આઝાદી પ્રાપ્ત કરી લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા રજવાડાઓનું દેશમાં વિલીનીકરણ કરાયેલ ડૉ. બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતને પોતાનું બંધારણ મળ્યું હતું અને ત્યારથી આ દિવસને આપણું રાષ્ટ્ર પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવીએ છીએ.

વિશેષમાં મેયરશ્રીએ જણાવ્યું હતું કે, દેશના આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનો વિકાસ સતત આગળ વધી રહેલ છે. થોડા સમય પહેલા માનનીય પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે લાઈટ હાઉસ પ્રોજેક્ટ, જુદા જુદા ઓવર બ્રિજ, સાયન્સ મ્યુઝિયમ વિગેરેનું લોકાર્પણ તેમજ અદ્યતન ઇન્ડોર સ્ટેડિયમનું ખાતમુહૂત કરવામાં આવ્યું. રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા રામવન, ઇલેક્ટ્રિક બસ, ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન વિગેરે ખુલ્લા મુકેલ હતા.

આગામી ત્રણેક માસમાં કાલાવડ રોડ જડુંસ પાસેનો તથા કે.કે.વી. ચોક પર બની રહેલ ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે તથા આવનારા સમયમાં ઇલેક્ટ્રિક બસ માટેનો ચાર્જિંગ ડેપો અને ઇલેક્ટ્રિક સ્મશાન, નવી લાઈબ્રેરીનું પણ લોકાર્પણ કરવામાં આવશે તેમજ સ્માર્ટ સીટી એરિયામાં ચાલી રહેલ અટલ સરોવરની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ થતા રંગીલા રાજકોટને હરવા ફરવા માટે નવું એક સ્થળ મળશે.

દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશના કારણે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે. વિશ્વના અનેક દેશો જોડાયેલ G-20નું સુકાન ભારત દેશને નેતૃત્વ કરવાનું ગૌરવ પ્રાપ્ત થયેલ છે જે સમગ્ર દેશવાસીઓ માટે ગૌરવની બાબત છે.

આજના આ પ્રજાસતાક પર્વ પ્રસંગે ચાલો સૌ સાથે મળી સંકલ્પ કરીએ કે,

- દર વર્ષે એક વૃક્ષ વાવી તેનું જતન કરીશ.
- પાણી બચાવીએ, વોટર રીચાર્જ કરીએ.
- પોલીથીન-પ્લાસ્ટીકનો ઉપયોગ નહી કરું.
- જાહેર સાહસોને નુકસાન નહી પહોંચાડું.
- જ્યાં ત્યાં કચરો ફેકીશ નહિ.

અંતમાં, ફરીને પ્રજાસતાક પર્વ પ્રસંગે સૌ નગરજનોને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું.

ભારત માતા કી જય.....

વંદેમાતરમ... ..

(પી.એ.ટુ મેયર)